



જનસંપર્ક અધિકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૦૧/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૯ કેસ કરી, ૨૮ વ્યક્તિઓને ઝડપી, ૪૫ લીટર દેશી દારૂ, ૧૧ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૮૮ ક્વોટર ઈંગ્લીશ દારૂ અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૩ કેસ કરી, ૦૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૪૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૯ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૮૬/૧૯

શહેરકોટડા : રોનકભાઈ રમેશભાઈ પટેલ (ઉ.વ.૨૭)(રહે.ઉત્તર ગુજરાત પટેલ સોસાયટી, વિભાગ-૨, મોહન સિનેમા સામે, અસારવા) એ તા.૨૮/૦૧/૨૦૧૮ ના રોજ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૦૧/૨૦૧૯ સવારના ૧૧/૦૦ થી બપોરના ૨/૦૦ વાગ્યા દરમિયાન સાયોના આર્કેડ, શ્યામ શીખરની બાજુમાં, દિનેશ ચેમ્બર સામે, બાપુનગર ટોલનાકા ખાતે સાંઠનાથ એસોસીએટ ખાતે રોનકભાઈ એ પોતાની પાસેના રોકડ રૂપિયા ૧,૪૬,૫૦૦/- દેના બેંક અસારવા બ્રાંચના પોતાના ખાતામાં જમા કરાવવા માટે પોતાની એક્ટીવા સાથે આરોપી મેહુલ કનૈયાલાલ ભાવસાર (રહે.કૈલાશનગર સોસાયટી, શ્રેણીકનગરની સામે, સ્ટેટ બેંકના ખાંચામાં, બાપુનગર) ને આપેલ હતા જે રૂપિયા ખાતામાં જમા નહી કરી પરત નહીં આવી રોનકભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.વી.ધોકડીયા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૮૭/૧૯

કૃષ્ણનગર : શીલુબહેન વા/ઓ અનીશસિંહ રાજપુત (ઉ.વ.૨૦)(રહે.રાધિકા ટેનામેન્ટ, ઉમા હોસ્પિટલ સામે, નવા નરોડા) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૧/૧૯ બપોરના ૨/૧૫ વાગ્યાના સુમારે પોતાના ખુલ્લા ઘરમાં બે અજાણ્યા પુરૂષ (૪૦ થી ૫૫ વર્ષના આશરના)એ ભેગામળી શીલુબહેન પાસે પિવાનુ પાણી માંગતા, શીલુબહેન પાણી લેવા રસોડામાં જતા, ઘરનો પેટી પલંગ ખોલી નાંખતા, શીલુબહેને બુમા-બુમ કરતા તેમના રૂમાલ માંથી કોઈ નશીલો પદાર્થ સુગાડી દેતા, શીલુબહેન બેભાન થઈ જતા, આરોપીઓએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૭૫,૦૦૦/- મતાની ચોરી કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.જી.વહોનીયા ચલાવે છે.

**સરખેજ :** અશ્વીનીભાઈ નવલભાઈ શર્મા (રહે.બિલ્ડીંગ-૦૭ શુભ ગૃહ ટાટા હાઉસીંગ, મોટી ભોયન, કલોલ, જિ-ગાંધીનગર) એ તા.૧૯/૦૧/૨૦૧૯ ના કલાક ૧૦/૦૦ વાગ્યા પહેલાના કોઇપણ સમયે જમીન પ્લોટ નંબર-૨૯૪-૨ અને ૨૯૪-૪ મોજે-સરખેજ, શાંતીપુરા સર્કલ નજીક સરખેજ ખાતે પાર્ક કરેલ ત્રણ કાર જેમાં (૧) સ્વીફ્ટ વીડીઆઇ ડીઝાયર કાર ચેચીસન-MA3CZF03SJF362984 તથા એન્જિન નંબર-3337140 કિંમત રૂપિયા ૭,૫૪,૯૦૧/- (૨) સ્વીફ્ટ વીડીઆઇ મોડેલની કાર ચેચીસ નંબર-MBHCZC03SJF212760 તથા એન્જિન નંબર 756246 કિંમત રૂપિયા ૬,૯૫,૯૩૦/- અને (૩) સ્વીફ્ટ વીડીઆઇ મોડેલની કાર ચેચીસ નંબર-MBHCZC03SJE197057 તથા એન્જિન નંબર-751916 કિંમત રૂપિયા ૬,૯૫,૯૩૦/- મળી ત્રણ ગાડીઓની કુલ કિંમત રૂપિયા ૨૧,૪૬,૭૬૧/- મતાની કોઇ અજાણી વ્યક્તિ સિક્યુરીટી કેબીનમાંથી ચાવીઓ ની ચોરી કરી, ચાવીઓથી કારના લોક ખોલી, ત્રણેય સ્વીફ્ટ કારની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.પી.સોનારા ચલાવે છે.

**નારોલ :** પ્રેમકુમાર શંકરસિંગ તોમર (ઉ.વ.૩૧)(રહે.હરજી દેસાઇની ચાલી ન્યુ મસ્જીદની સામે કુટ માર્કેટની પાછળ નરોડા) એ તા.૨૪/૦૧/૨૦૧૯ સાંજના ૭/૩૦ વાગ્યાના સુમારે નારોલ ખોડીયાર માતાના મંદિર પાસે રોડની સાઇડમાં પોતાની કાર નંબર જીજે.૦૧.એફ.ટી.૭૦૨૧ કિંમત રૂપિયા ૩,૫૦,૦૦૦/- મતાની પાર્ક કરી મુકી હતી. જેની કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરી લઇ ગઇ છે. આ અંગેની ફરીયાદ પ્રેમકુમાર તોમરે તા.૨૮/૧/૧૯ ના રોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સર્વેલન્સ સ્કોર્ડ નાઓ ચલાવે છે.

આત્મહત્યા:-

**ઓઢવ :** હસમુખભાઈ ગણેશભાઈ પટેલ (ઉ.વ.૪૨)(રહે.કિજ્જાપાર્ક સોસાયટી, રામેશ્વર એસ્ટેટ રોડ વિરાટનગર ઓઢવ) એ કોઇ અગમ્ય કારણસર તા.૨૮/૦૧/૨૦૧૯ ના કલાક ૨/૨૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે રૂમના છતના ભાગે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પલાસ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.